

નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી-૩૯૬૪૫૦

નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે નવા મંજૂર થયેલ ચાર પ્રોજેક્ટસના અમલીકરણની કાર્યોત્તર મંજૂરી આપવા બાબત...

જાહેરનામું  
નં.૬૯૩/૨૦૨૦

આથી સંબંધકર્તા સર્વેને જાણ કરવામાં આવે છે કે, તા.૧૩/૧૨/૨૦૧૯ના રોજ નવસારી ખાતે મળેલ સંચાલક મંડળની ૪૩મી બેઠકની કાર્યનોંધના મુદ્દા નંબર ૪૩.૦૫થી નીચે મુજબ ઠરાવવામાં આવેલ છે.

"આથી ઠરાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે આ સાથે સામેલ પત્રક (Appendix-43.05(i))માં દર્શાવ્યા મુજબ નવા મંજૂર થયેલ ચાર પ્રોજેક્ટસ હેઠળની ગ્રાન્ટ અને પ્રવૃત્તિઓની નોંધ લઈને સંચાલક મંડળ દ્વારા તેના અમલીકરણની કાર્યોત્તર મંજૂરી આપવામાં આવે છે."

જા.નં. નકૃયુ/વિશિનિ/ટી-૧/સં.મં./૪૩.૦૫/વેબ-૬૧/૨૦૨૦  
નવસારી તા.૨૧/૦૧/૨૦૨૦



વિસ્તરણ શિક્ષણ નિયામક  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી

**નકલ સવિનય રવાના પ્રતિ :**

૧. સંચાલક મંડળના સર્વે સભ્યશ્રીઓ તરફ જાણ સારું.
૨. વિસ્તરણ શિક્ષણ પરિષદના સર્વે સભ્યશ્રીઓ તરફ જાણ સારું.
૩. યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રીઓ તરફ જાણ સારું.

**નકલ જયભારત સહ રવાના પ્રતિ :**

૧. માન. કુલપતિશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી તરફ જાણ સારું.
૨. કુલસચિવશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી તરફ જાણ સારું.
૩. કુલસચિવશ્રીની કચેરીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ શાખા તરફ (૫ નકલમાં) જાણ સારું.
૪. તમામ યુનિટ/સબ યુનિટ કચેરીઓના વડાશ્રીઓ તરફ જાણ સારું.

## -: પત્રક :-

નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે નવા મંજૂર થયેલ ચાર પ્રોજેક્ટ્સના અમલીકરણની કાર્યોત્તર મંજૂરી આપવા બાબત...

અ.નં.	પ્રોજેક્ટનું નામ	મંજૂર કરનાર સંસ્થા	પ્રોજેક્ટનો મુખ્ય હેતુ	પ્રોજેક્ટનું કેન્દ્ર/ સ્થળ	નાણાંકિય ફાળવણી (રૂ. લાખમાં)
૧	Attracting and Retaining Rural Youth in Agriculture (ARYA)	ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી	યુવા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા રહે તે માટે ગ્રામ્ય સ્તરે કૃષિ, બાગાયત અને મત્સ્યપાલન આધારિત નાના વ્યાવસાયિક એકમો ઉભા કરીને સ્વરોજગારીની તકો ઉભી કરવી.	કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી	૬.૮૪
૨	Production of vegetable seedlings and fruit crop planting material through plug technology	નાયબ બાગાયત નિયામકશ્રી, સુરત	સુરત જિલ્લાના ખેડૂતો અને ગ્રામ્ય યુવકોને પ્લગ નર્સરી થકી ખાત્રીયુક્ત પ્લાન્ટીંગ મટીરિયલ્સ, વ્યાવસાયિક તાલીમ અને સ્વરોજગારી પુરા પાડવા તથા બાગાયતી પાકોના ઉત્પાદન થકી વધુ આવક ઉભી થાય તેવા પ્રયત્નો હાથ ધરવા.	કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત	૩૦.૦૦
૩	Development demonstration and awareness programme of organic farming in South Gujarat	ખેતી નિયામકશ્રી, ગાંધીનગર, ગુજરાત સરકાર	દક્ષિણ ગુજરાતમાં સજીવ ખેતીનો વ્યાપ વધે તેમ જ વધુને વધુ ખેડૂતો અપનાવે તે સારું અગ્ર હરોળના નિદર્શનો, પ્રેરણા પ્રવાસ, ખેડૂત શિબિર, ક્ષેત્ર દિન વિ. વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરીને ખેડૂતોમાં સજીવ ખેતી પ્રત્યે જાગૃતિ લાવવી.	કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી	૪૪.૧૦
૪	District Agro Met Unit (DAMU)	ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી	હવામાનને લગતી રોજબરોજની માહિતી આધુનિક ઉપકરણો દ્વારા વૈજ્ઞાનિક ઢબે એકત્રિત કરીને સ્થાનિક ખેતી કાર્યોમાં તથા રાષ્ટ્રિય કક્ષાએ કૃષિ વિકાસ માટે ઉપયોગી થવું.	કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, દેડીયાપાડા અને સુરત	૪.૮૦ X ૩ = ૧૪.૪૦

તા.૨૧/૦૧/૨૦૨૦

